

પ્રકરણ-૧૪ (નિયમ સંગ્રહ -૧૩)

આપેલ રાહતો,પરમીટ કે અધિકૃત મેળવનાર ની વિગતો.

૧૪. ૧. કાર્યક્રમનું નામ :- સીધા ધિરાણની યોજના
૨. પ્રકાર:- (રાહત / પરમીટ / અધિકૃત)
(સીધા ધિરાણની યોજનામાં લોન)
૩. ઉદ્દેશ:- નિગમનો ઉદ્દેશ અને હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરીકોની ઉન્નતિ માટે આર્થિક અને નાણાંકીય મદદ કરી સ્વરોજગારી પુરી પાડવાનો છે.
૪. નક્કી કરેલ લક્ષ્યાંક: વર્ષ:-૨૦૨૦-૨૧

ક્રમાંક	યોજનાનું નામ	ભૌતિક લક્ષ્યાંક	નાણાંકીય લક્ષ્યાંક (રૂ.લાખમાં)
૧	સીધા ધિરાણની યોજના (રાજ્ય સરકાર)	૪૯૪	૧૦૯૦.૭૩
૨	સીધા ધિરાણની યોજના (રાષ્ટ્રીય નિગમ)	૧૨૦	૨૦૦.૭૯

૫. પાત્રતા:-

સીધા ધિરાણની યોજના:-

(૧) અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

(૨) અરજદારની ઉંમર ૨૧ વર્ષથી વધુ અને ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.

(૩) અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઈએ.

પરંતુ રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. (૪) અરજદારને ધંધા/વ્યવસાયનું જ્ઞાન હોવું જોઈએ.

૬. માપ દંડો :- ઉપર મુજબ.

૭. અત્રેના નિગમ ધ્વારા અરજદારો પાસેથી દૈનિક પત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અરજીઓ જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)ની કચેરીએથી ચકાસણી થઈ ઓનલાઇન પદ્ધતિથી નિગમના લોગઇન આવે છે.

૮. ત્યારબાદ અરજદારશ્રીના ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ નિગમની લાભાર્થી પસંદગી સમિતિ સમક્ષ અરજીઓ મુકવામાં આવે છે. જે તે વ્યવસાય માટે તેમની ક્ષમતા જોઈ લાભાર્થી પસંદ કરી અરજી મંજૂર કરવામાં આવે છે.
૯. રાહતની સમય મર્યાદા :- ૪ થી ૧૦ વર્ષ
૧૦. અરજી ફોર્મની ફી :- ઓનલાઇન પદ્ધિતિથી.
૧૧. ઓનલાઇન અરજી કરવા માટે <https://gbcddonline.gujarat.gov.in> ઉપર ઉપલબ્ધ થઈ શકશે.
૧૨. બિડાણોની યાદી :-સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ઉંમર અંગેના આધારોમાં સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ/જન્મ તારીખ અંગે જન્મનો પુરાવો, અને આધાર કાર્ડ. રેશન કાર્ડ, મતદાર યાદી કાર્ડ, અરજદારનો ફોટો.
૧૩. બિડાણોનો નમૂનો :- --
૧૪. લાભાર્થીઓની યાદી નિગમની કચેરીએથી ઉપલબ્ધ થઈ શકશે.
૧૫. આપેલ લાભની વિગત :-
સીધા ધિરાણની યોજનામાં પ્રકરણ ૧૩.(૧) થી ૧૩.(૯)
૧૬. લાભોનું વિતરણ :- નિગમ કક્ષાએથી.